

ત્વરિત જાહેરાત માટે

## ડેલોઈટ દ્વારા કાઉન્સિલ-અધિકૃત તપાસ પૂરી થઈ

બ્રમ્પટન, ઓન્ટેરિયો (સપ્ટેમ્બર 29, 2021) – સ્વતંત્ર તપાસકર્તા અને ફોરેન્સિક ઓડિટર ડેલોઈટ દ્વારા બ્રમ્પટન સીટી કાઉન્સિલને એપ્રિલ 22, 2021 નાં રોજ મળેલી, કર્મચારીઓની બાબતો સહિત, વહીવટી આચરણના સંબંધમાં આરોપોની તપાસ પૂરી થઈ છે.

સીટી કાઉન્સિલે આરોપોની સમીક્ષા કરવા ઉપરાંત, સીટીની પ્રક્રિયા કે કર્મચારીઓને સંબંધિત કોઈ બાબતો જાણાવવા ઈચ્છતા કર્મચારીઓ અને રહેવાસીઓ માટે તક પૂરી પાડવા અનામી પોર્ટલ ખોલવાનો નિર્દેશ ડેલોઈટને આપ્યો હતો.

ડેલોઈટ દ્વારા વ્યાપક તપાસ પછી, તેઓના કર્મચારીઓ અને ત્રાહિત પક્ષ વિકેતાઓ દ્વારા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ભેદભાવભરી વર્તણૂક જોવામાં આવી ન હતી.

ડેલોઈટને મળેલા જાહેર આરોપોમાંથી, રિપોર્ટમાં જોવામાં આવ્યું કે કોર્પોરેટ નીતિઓ સંપૂર્ણપણે અનુસરવામાં આવી છે પણ ડિરેક્ટર-સ્તરે સીટીની નીતિઓ અને પ્રમાણભૂત સંચાલન કાર્યપદ્ધતિઓ સાથે વહીવટી ગેર-અનુપાલનના બે બનાવો બન્યા, જેમાંનો એક હયાત કામગીરીના વિસ્તરણ માટે ભરેલા સીમિત ટેન્ડરિંગ ફોર્મની ઊણપના સંબંધમાં અને અન્ય એક સીમિત ટેન્ડરિંગ ફોર્મની ઊણપના સંબંધમાં હતો. દસ્તાવેજીકરણ સંબંધિત અનુપાલનના જોખમો ઘટાડવાના હેતુ સાથે, સીટીના પ્રયત્નો હાલમાં નાણાકીય પ્રક્રિયાની પહેલો સ્વચાલિત કરવા હાલમાં પ્રગતિમાં છે.

તપાસના છ કાઉન્સિલ-નિર્દેશિત ક્ષેત્રોમાંથી દરેકના સંબંધમાં ડેલોઈટની શોધોનો સારાંશ નીચે આપ્યો છે.

### 1. ભરતી વ્યવહારો

ડેલોઈટ દ્વારા અયોગ્ય ભરતીના આરોપોની તપાસ કરવામાં આવી, જે સમીક્ષા કરવા પર પ્રમાણભૂત ન હતા અથવા આગળ તપાસ કરવા પૂરતી વિગતની ઊણપ રહી.

### 2. ખરીદી પ્રક્રિયા સંબંધિત વિવાદો

ડેલોઈટ દ્વારા તપાસાયેલા છ પૈકી ચાર કરારો ખરીદીના પેટા-કાનૂન અને પ્રમાણભૂત સંચાલન કાર્યપદ્ધતિઓથી સંકલિત હતા. ડેલોઈટ દ્વારા સીટીની નીતિઓ અને હયાત કામગીરીના વિસ્તરણ માટે ભરેલા સીમિત ટેન્ડરિંગ ફોર્મની ઊણપને સંબંધિત પ્રમાણભૂત સંચાલન કાર્યપદ્ધતિઓ સાથે ગેર-અનુપાલનનો એક બનાવ ઓળખી કાઢવામાં આવ્યો, અને એક સીમિત ટેન્ડરિંગ ફોર્મની ઊણપ માટે, બંને ડિરેક્ટર-સ્તરે.

### 3. ભેદભાવભર્યા આરોપો

ભેદભાવભરી વર્તણૂકના આરોપો પ્રમાણભૂત ન હતા અથવા આગળ તપાસ કરવા પૂરતી વિગતની ઊણપ હતી.

### 4. કાર્યસ્થળે ગુંડાગીરી અને સતામણી

તપાસનું સમાપન થવાના સમયે, સીટીની નીતિઓ અને તે સમયે અમલી પ્રમાણભૂત સંચાલન કાર્યપદ્ધતિઓના ઉલ્લંઘનોના આરોપોના સંબંધમાં કોઈ નિષ્કર્ષ નિકળ્યો ન હતો.

**5. માહિતીનો વિનાશ**

માહિતીના વિનાશના આરોપોને પ્રમાણ મળ્યું ન હતું.

**6. પ્રમાણભૂત નીતિ અને કાર્યપદ્ધતિ સાથે અનુપાલન**

અયોગ્ય વળતરના આરોપોની સમીક્ષા કરવાથી, ડેલોઈટને ન તો પ્રમાણભૂત પ્રક્રિયાની બહાર અને ન તો પહેલેથી હયાત સંબંધથી પક્ષપાતને લીધે કોઈ વધારો આપ્યો હોવાનો કોઈ પુરાવો ધ્યાનમાં આવ્યો ન હતો. અયોગ્ય કર્મચારી તબદીલીના આરોપોની સમીક્ષા કરવાથી, ડેલોઈટને કોઈ નીતિ ઉલ્લંઘનો ધ્યાનમાં આવ્યા નહીં.

આ તારણોને ઓન્ટેરિયો ઓમ્બુડ્સમેન અને પીલ રીજીયનલ પોલીસે આ બાબતની અગાઉ કરેલી સમીક્ષાને આગળ ટેકો મળ્યો છે.

સીટી કર્મચારીઓ અને ત્રાહિત પક્ષ વિક્રેતાઓ સહિત, તપાસમાં સહયોગ આપનાર દરેક વ્યક્તિનો આભાર માને છે.

ડેલોઈટનો અહેવાલ જાહેરમાં સીટીની [વેબસાઈટ](#) પર ઉપલબ્ધ છે, અને અહેવાલ સાહિત્યને લગતા પ્રશ્નો ડેલોઈટને પહોંચાડવા જોઈએ.

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)